

તા ૧૯.૦૫.૨૦૧૬ ના રોજ યોજનાર “લોક સંવાદ સેતુ કાર્યક્રમ” અંતર્ગત રજૂ થયેલ પ્રશ્નની વિગત

લોક સંવાદ સેતુ તારીખ : ૧૯.૦૫.૨૦૧૬

સ્થળ : બાબરા તાલુકા પંચાયત

સમય : બપોરે ૦૩:૦૦ કલાકે

તાલુકાનું નામ:- બાબરા

જીલ્લાનું નામ : અમરેલી

પ્રશ્ન રજૂ.નં.	અરજદારશ્રીનું નામ અને સરનામું	અરજીની વિગત	સંબંધિત વિભાગ અથવા કચેરી	નિકાલ અંગેની વિસ્તૃત વિગત	રીમાર્ક્સ
૬૩૯	શ્રી બાલાભાઈ નારણભાઈ મુ-ગમાંપીપળીયા	યુનીટ વધારે લખવા બાબત તથા મીટર ભાડા બાબત.	પેટા વિભાગીય કચેરી, પી જી વી સી એલ, વાસાવડ	સદર અરજદારને ૧૨૦ યુનિટનું બિલ આપવામાં આવેલ પરંતુ અરજદાર દ્વારા રજૂઆત કરતા તેઓના વપરાશ મુજબનું ૭૦ યુનિટનો સુધારો કરી આપેલ છે. જે આપની નમ્ર જાણ સારું. જ્યાં કંપનીનું મીટર મુકવામાં આવેલ હોય ત્યાં મીટર ભાડું GERC નાં પ્રવર્તમાન નિયમ મુજબ જ લેવામાં આવે છે. જો અરજદારનું પોતાની માલિકીનું મીટર હોય ત્યાં મીટર ભાડું લેવામાં આવતું નથી.	નિકાલ
૬૬૦	શ્રી શિવાભાઈ આર પાનસુરીયા મુ-ગમાંપીપળીયા	વાડીમાં જેટલા એચ. પી. નું કનેક્શન તેટલા એચ.પી. સુધી મોટર ચલાવવા બાબત.	પેટા વિભાગીય કચેરી, પી જી વી સી એલ, વાસાવડ	કંપનીના પ્રવર્તમાન સર્ક્યુલર નંબર CE/GUVNL/RE/87 DT-07.06.2006 મુજબ ખેતીવાડીનાં હયાત કનેક્શનમાં એક જ મોટર વાપરવાની છૂટ આપેલ છે. આમ સદર પ્રશ્ન નીતિવિષયક છે.	નિતી વિષયક
૬૪૧	શ્રી ભાનુભાઈ મોહનભાઈ પાનસુરીયા મુ-ગમાંપીપળીયા	ખોટો વિજ ઇંડ દુર કરવા બાબતે.	પેટા વિભાગીય કચેરી, પી જી વી સી એલ, વાસાવડ	સદર અરજદારને ત્યાં વિજ કંપનીના ચેકિંગ અધિકારી દ્વારા તા. ૧૪.૧૦.૧૪ નાં રોજ કનેક્શન ચેક કરવામાં આવેલ. જેમાં કરારિત વિજ ભાર ૭.૫ હોર્સ પાવરની સામે ૧૦ હોર્સ પવાર જોડેલ હતા. પરંતુ અધિકારીશ્રી દ્વારા અરજદારનાં ગ્રાહક નંબર ભૂલથી ખોટા લખાયેલ હતા. તેથી પ્રથમ કાન્ટાબેન પાનસુરીયા નાં નામે પુરાવાણી બિલ આપવામાં આવેલ. ત્યાર બાદ સંબંધિત કચેરીને આ અંગેની હકીકતલક્ષી જાણ થતા અરજદારને ચેકિંગ શીટમાં દર્શાવ્યા મુજબ વધારાના ૨.૫ હોર્સ પાવરનું કામચલાઉ પૂરવણી બિલ કંપનીના પ્રવર્તમાન નિયમ મુજબ આપવામાં આવેલ છે. જે ભરવાપાત્ર છે.	નિકાલ